

[A-22]

No. of printed pages: 03

SARDAR PATEL UNIVERSITY
B. Com. (VIth Semester) Examination
2016

Wednesday, 6th April

10.30 am - 12.30 pm

UB06ECOM01 - Advanced Accounting & Auditing : Paper - XI
(Adv. Corporate Accounting)

Total Marks : 60

નોંધ : જમણી બાજુના આંકડા દર્શાવે છે.

પ્ર.૧ તા. ૩૧-૩-૨૦૧૫ના રોજના બે કંપનીઓના પાકા સરવૈયાં નીચે મુજબ છે.

(૧૫)

જવાબદારીઓ	હિરા લિ. (રૂા.)	મોતી લિ. (રૂા.)	મિલકતો	હિરા લિ. (રૂા.)	મોતી લિ. (રૂા.)
રૂા. ૧૦૦નો તેવા ઈક્વિટી શેર	૫૦૦૦૦૦	૨૦૦૦૦૦	જમીન-મકાન	૪૦૦૦૦૦	૧૦૦૦૦૦
રૂા. ૧૦૦નો તેવા પ્રેફરન્સ શેર	૩૦૦૦૦૦	૧૦૦૦૦૦	પ્લાન્ટ-ચંત્ર	૫૦૦૦૦૦	૨૦૦૦૦૦
૧૦% ના ડિવેન્ચર	૨૦૦૦૦૦	૧૦૦૦૦૦	વાહન	૧૦૦૦૦૦	૧૦૦૦૦૦
લેણદારો	૩૦૦૦૦૦	૨૦૦૦૦૦	સ્ટોક	૨૦૦૦૦૦	૧૦૦૦૦૦
સામાન્ય અનામત	૨૦૦૦૦૦	૧૦૦૦૦૦	દેવાદારો	૨૦૦૦૦૦	૧૦૦૦૦૦
			બેક સિલક	૧૦૦૦૦૦	૧૦૦૦૦૦
	૧૫૦૦૦૦૦	૭૦૦૦૦૦		૧૫૦૦૦૦૦	૭૦૦૦૦૦

બંને કંપનીઓનું તા. ૧-૪-૧૫ના રોજથી સંયોજન કરવા એચએમ લિ. સ્થાયી, જેની સત્તાવાર મૂડીમાં રૂા. ૧૦૦નો તેવા ૨૦૦૦૦૦ ઈ.શેર અને રૂા. ૧૦૦નો તેવા ૧૦%ના ૧૦૦૦૦ પ્રેફરન્સ શેરનો સમાવેશ થાય છે. ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ હતી.

(અ) હિરા લિ. માટે :- (૧) જૂના ૧૦ ઈ. શેરના બદલે નવા ૨૫ ઈ.શેર આપવા.

(૨) જૂના ૧૦ પ્રે. શેરના બદલામાં નવા ૧૨ પ્રે.શેર પૂરા ભરાયેલા ગણીને આપવા.

(બ) મોતી લિ. માટે :- (૧) જૂના ૧૦ ઈ. શેરના બદલે નવા ૮ ઈ.શેર આપવા.

(૨) પ્રત્યેક એક પ્રે. શેર સામે એક નવો પ્રે. શેર આપવો.

પ્રાથમિક ખર્ચા રૂા. ૧૦૦૦૦ થયા. નવી કંપનીએ બાકી રહેલા ઈ. શેર શેરદીઠ રૂા. ૧૨ લેખે જાહેર જનતામાં બહાર પાડ્યા, જે પૂરેપૂરા ભરપાઈ થયા.

એચએમલિ.ના ચોપડે શરૂઆતની આમનોંધો તથા પાકુ સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્ર.૧ ઉપરના પ્રશ્ન ૧માં આપેલી માહિતીને આધારે હિરા લિ.ના ચોપડે આમનોંધો લખો.

(૧૫)

પ્ર.૨

(૧) મૂલ્ય વિશ્લેષણની વ્યાખ્યા આપો. તેની મહત્વની લાક્ષણિકતાઓ સમજાવો.

(૦૯)

(૨) નોંધ લખો : મૂલ્યના પ્રકાર

(૦૬)

અથવા

પ્ર.૨ ટૂંકનોંધ લખો. (ગમ તે બે)

(૧૫)

(અ) મૂલ્ય વિશ્લેષણના લાભ

(બ) સંપૂર્ણ ગુણવત્તા સંચાલન (T.Q.M.)

(ક) મૂલ્ય વિશ્લેષણની પદ્ધતિઓ

પ્ર.૩ ૩૧-૩-૨૦૧૫ના રોજના પાકા સરવૈયાં નીચે મુજબ હતા.

(૧૫)

જવાબદારીઓ	સીતા લિ. (રૂા.)	ગીતા લિ. (રૂા.)	મિલકતો	સીતા લિ. (રૂા.)	ગીતા લિ. (રૂા.)
રૂા. ૧૦૦નો તેવા શેર	૨૪૦૦૦૦	૭૫૦૦૦	જમીન મકાન	૧૮૦૦૦૦	૬૮૦૦૦
સામાન્ય અનામત	૬૦૦૦૦	૭૨૦૦	દેવાદારો	૨૪૦૦૦	૧૮૦૦૦
ન.નું. ખાતુ	૭૮૦૦૦	૧૮૦૦૦	સ્ટોક	૬૦૦૦૦	૨૩૨૦૦
લેણદારો	૧૦૦૦૦	૧૦૦૦૦	ગીતા લિ.ના ૬૦૦૦ શેર	૧૦૨૦૦૦	-----
લેણી હૂંડી	૮૦૦૦	૬૦૦૦	મીતા લિ.ના શેર	૩૦૦૦૦	૭૦૦૦
	૩૯૬૦૦૦	૧૧૬૨૦૦		૩૯૬૦૦૦	૧૧૬૨૦૦

નીચેની માહિતી ધ્યાનમાં લઈને ૩૧-૩-૧૫ના રોજનું એકત્રિત પાકુ સરવૈયું બનાવો.

- (૧) સીતા લિ. એ ગીતા લિ.ના શેર ખરીદ્યા તે તારીખે ગીતા લિ.ના ચોપડે ન.નું. ખાતાની જમાબાકી અને સામાન્ય અનામતની બાકી અનુક્રમે રૂા. ૮૦૦૦ અને રૂા. ૭૨૦૦ હતી.
- (૨) ગીતા લિ. એ સીતા લિ. પાસેથી ખરીદેલા માલમાંથી રૂા. ૧૨૦૦૦નો માલ સ્ટોકમાં હતો. સીતા લિ. એ પડતર પર ૨૦% નફો ચકાવેલ છે.
- (૩) સીતા લિ.ના દેવાદારોમાં રૂા. ૫૦૦૦ ગીતા લિ. પાસેના લેણા છે જે સમાયેલ છે.

અથવા

પ્ર.૩ આકાશ લિ. અને ઘરતી લિ.ના તા. ૩૧-૧૨-૧૫ના રોજના પાકા સરવૈયાં નીચે મુજબ છે. (૧૫)

દેવાં	આકાશ લિ. (રૂા.)	ઘરતી લિ. (રૂા.)	મિલકતો	ઘરતી લિ. (રૂા.)	આકાશ લિ. (રૂા.)
રૂા. ૧૦૦નો તેવા શેર	૧૦૦૦૦૦૦	૪૦૦૦૦૦	પ્લાન્ટ-ચંત્રો	૯૦૦૦૦૦	૨૫૦૦૦૦
ન.નું. ખાતુ	૧૨૦૦૦૦	-----	ફર્નિચર	૧૦૦૦૦	૨૦૦૦૦
સામાન્ય અનામત	૨૦૦૦૦૦	-----	સ્ટોક	૨૦૦૦૦૦	૪૦૦૦૦
લેણદારો	૧૮૦૦૦૦	૧૦૦૦૦૦	દેવાદારો	૪૦૦૦૦	૨૦૦૦૦
			ઘરતી લિ.ના ૩૦૦૦ શેર, રૂા. ૮૦ લેખે	૨૪૦૦૦૦	-----
			બેંક સિલક	૧૧૦૦૦૦	૧૮૦૦૦
			ન.નું. ખાતુ	-----	૧૫૨૦૦૦
	૧૫૦૦૦૦૦	૫૦૦૦૦૦		૧૫૦૦૦૦૦	૫૦૦૦૦૦

આકાશ લિ. એ ઘરતી લિ.ના શેર ૧-૪-૧૫ના રોજ ખરીદ્યા હતા. તા. ૧-૧-૧૫ના રોજ ઘરતી લિ.ના ચોપડા ન.નું. ખાતાની ઉધાર બાકી રૂા. ૨૦૦૦૦૦ દર્શાવે છે. ઘરતી લિ.ના લેણદારોમાં રૂા. ૨૦૦૦૦ આકાશ લિ.ને ખરીદેલ માલના ચુકવવાના હતા.

ઉપરની વિગતો પરથી તા. ૩૧-૧૨-૨૦૧૫ના રોજનું એકત્રિત પાકુ સરવૈયું તૈયાર કરવાનું છે.

પ્ર.૪ એક રાષ્ટ્રીય કૃત બેંકનું ૩૧ માર્ચ ૨૦૧૬ના રોજનું કાચુ સરવૈયું નીચેની વિગતો દર્શાવે છે.

(૧૫)

વિગત	(રૂા.)	વિગત	(રૂા.)
શેરમૂડી	૫૦૦૦૦૦	માંગ પર મળે તેવી રકમ	૨૫૦૦૦૦
દેવીહૂંડીઓ	૨૫૦૦૦૦	રોકાણો	૧૩૦૦૦૦૦
ફર્નિચર	૫૦૦૦૦	જમીન-મકાન	૩૫૦૦૦૦
ખરીદેલ અને વટાવેલી હૂંડીઓ	૨૦૦૦૦૦	લોન	૫૦૦૦૦૦
કેશ કેડિટ	૭૫૦૦૦૦	ચાલુ ખાતા	૧૨૫૦૦૦૦
બાંધી મુદતી થાપણો	૭૦૦૦૦૦	ઉછીના નાણાં	૧૫૦૦૦૦
ચાલુ વર્ષનો નફો	૨૦૦૦૦૦	હાથ પર રોકડ	૮૦૦૦૦
રીઝર્વ બેંકમાં રોકડ	૪૨૦૦૦૦	બચત થાપણો	૩૫૦૦૦૦

૧. સત્તાવાર મૂડીમાં પ્રત્યેક રૂા. ૧૦૦નો તેવા ૧૦૦૦૦ શેર છે.
૨. ચાલુ વર્ષે નફો વટાવેલી હૂંડીઓના વળતરનો હવાલો રૂા. ૧૫૦૦૦ નાખ્યા પહેલાંનો છે.
૩. બેંક સામે થયેલ દાવો જેને દેવા તરીકે સ્વીકારેલ નથી તે રૂા. ૨૦૦૦૦૦ હતો.
૪. કાનૂની અનામત ભરાયેલ શેરમૂડી જેટલું જ છે. ચાલુ વર્ષે પણ જરૂરી જોગવાઈ કરવાની છે. જરૂરી પરિશિષ્ટો સાથે પાકુ સરવૈયું તૈયાર કરો.

અથવા

પ્ર.૪ બેંક ઓફ ઈન્ડિયાના તા. ૩૧-૩-૧૬ના રોજના કાચા સરવૈયા પરથી કેટલીક બાકીઓ લેવામાં આવી છે. ફોર્મ બી મુજબ તેનું ન.નું. ખાતું બનાવો. તે અંગે પરિશિષ્ટ નં. ૧૩ થી ૧૬ પણ આપો.

	રૂા.
શેરમૂડી (રૂા. ૧૦ લેખેનો શેર)	૮૦૦૦૦૦૦
લોનનું વ્યાજ	૧૦૦૦૦૦૦
ઓવરડ્રાફ્ટનું વ્યાજ	૩૦૦૦૦૦
કેશકેડિટનું વ્યાજ	૨૫૦૦૦૦
બાંધી મુદતની થાપણો પર વ્યાજ	૨૨૦૦૦૦
બચતખાતા પર વ્યાજ	૧૧૦૦૦૦
ચાલુ થાપણો પર વ્યાજ	૫૦૦૦
ઉછીની લીધેલી રકમ પર વ્યાજ	૩૦૦૦
હૂંડીઓ પર મળેલ વટાવ	૪૨૦૦૦
વટાવેલ હૂંડીઓનું વળતર (૧-૪-'૧૫)	૮૦૦૦
ન.નું. ખાતાની જમા બાકી (૧-૪-'૧૫)	૩૦૦૦૦૦
ગ્રાહકો પાસેથી વસૂલ મળેલ બેંક ચાર્જ	૫૫૦૦૦
પગાર અને ભથ્થાં	૧૩૦૦૦૦
લોકરનું ભાડુ	૬૨૦૦૦
ચૂકવેલ ભાડુ અને કર	૩૦૦૦૦
કાનૂની ખર્ચા	૮૦૦૦૦
વહીવટી ખર્ચા	૮૦૦૦૦
ઓડિટ ફી	૩૦૦૦૦
કિરેકટર ફી	૫૦૦૦૦

અન્ય વિગતો :- (૧) ૩૧-૩-૨૦૧૬ના રોજ વટાવેલી હૂંડીઓનું વળતર રૂા. ૧૦૦૦૦ છે.

(૨) દાલખાદ અંગે રૂા. ૨૦૦૦૦ તથા રૂા. ૫૦૦૦૦ની જોગવાઈ કરો.

(૩) સંચાલકોએ શેરમૂડી પર ૧૦ ટકા લેખે કિવિડન્ડ સૂચવ્યું છે.
